

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૪/૨૦૧૭ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૮૭૨/૧૭

અડાલજ પોલીસ સ્ટેશન તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ના વણ શોધાયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ

સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો જમ્પ થયેલ આરોપીને પકડવા આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી. ના પો.સ.ઇ. શ્રી વી.એચ.જાડેજા તથા પોસઇ શ્રી એમ.કે.ઝાલા નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન સરખેજ ચાર રસ્તા પાસે આવતા હે.કો. પ્રફુલભાઇ રામજીભાઇ તથા પો.કો. વિજયસિંહ બળવંતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે હાજીબાવાની કુંઇ વેજલપુર ખાતે હનીફ ઉર્ફે બાડો s/o સુરાસાદીક સંન્ધીડફેર ઉવ.૨૧ ધંધો:સીમચોકી રહે, ગામ:ગાંગડ, હશરફખાન પઠાણના ખેતરમાં તા.બાવળા જી. અમદાવાદને ઝડપી લેવામાં આવેલ. જેની પુછપરછ કરતાં પોતે તથા જમાલ દાઉદ તથા રઝાક જુમા તથા રમઝાન દાઉદ તથા લાલા કાળું તથા ગેલા ઉમર નાઓએ ભેગા મળી શેરથા ટોલટેક્ષ પાસે તથા વીસેક દિવસ અગાઉ સામરખા એક્સપ્રેસ હાઇવે ઉપર લુંટ કરેલાની હકીકત જણાવેલ. જેથી આ બાબતે (૧) અડાલજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૪/૨૦૧૭ ઇપીકો કલમ ૩૯૪ મુજબ (૨) આણંદ રૂરલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૬/૨૦૧૭ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુના નોંધાયેલ હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ આરોપી અગાઉ રાજકોટ ખાતે પકડાયેલ છે. તા.૨૫/૦૪/૨૦૧૭

છ વર્ષથી લુંટના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ

સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો જમ્પ થયેલ આરોપીને પકડવા આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી. ના પો.સ.ઇ. શ્રી જે.કે.રાઠોડ તથા પોસઇ શ્રી એન.એન.રબારી નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન રોયલ અકબર ટાવર જુહાપુરા ખાતે આવતા પો.કો. ચેતનકુમાર રામુભાઇ તથા પો.કો. હિતેન્દ્રકુમાર શંકરલાલ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે અંબર ટાવર જુહાપુરા ખાતેથી કાવો ઉર્ફે કાળો s/o દાઉદભાઇ સંન્ધીડફેર ઉવ.૪૦ ધંધો:સીમચોકી રહે, ગામ:ગાંગડ, હશરફખાન પઠાણના ખેતરમાં તા.બાવળા જી. અમદાવાદને ઝડપી લેવામાં આવેલ. જેની પુછપરછ કરતાં પોતે (૧) સુરત જીલ્લાના કામરેજ પો.સ્ટે.ફ. ગુ.ર.નં. ૨૩૭/૨૦૧૧ ઇપીકો કલમ ૩૯૪, તથા બીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૨) સુરત કામરેજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૧ ઇપીકો કલમ ૩૯૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪ (૩) સાણંદ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૩/૨૦૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુનામાં નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ. જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ આરોપી અગાઉ વટવા પોલીસ સ્ટેશન તેમજ કલોલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ છે. તા.૨૫/૦૪/૨૦૧૭

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.